

કેતકીબહેનની વાડી

— રમેશ ત્રિવેદી

એક હતાં કેતકીબહેન.

કેતકીબહેનના પણ્ણા એમને રોજ વાડીમાં ફૂલ લેવા મોકલે. વાડીમાં કાબર, ભમરાલૈ, ચકલી ને મોર ઊડાઊડ કરે, એમનો શોરબકોર સાંભળીને વાડી તો કંટાળી ગઈ હતી. વાડીને મનમાં થાય આ ચારેય જણે બેગાં મળીને મારું તો માથું પકવી નાખ્યું, એમને શાંતિ જાળવવા કેટકેટલી વાર કીધું, પણ પથર પર પાણી! હવે કરવું શું!? એણો તો એકવાર કેતકીબહેનને કરી ફરિયાદ; એ કહે :

જુઓ, તમે કેતકીબહેન,
કાબર કરે કેવાં વેન!
કલબલ એવી કર્યા કરે,
માથું મારું ભખ્યા કરે!

કેતકીબહેન કહે : ‘ઓહો! એમાં તે શું! હું હમણાં જ કાબરની ખબર લઈ નાખું છું.’ એણે કાબરને બોલાવી. કાબર હાજર થઈ ગઈ. કેતકીબહેને એના કાનમાં કશુંક કીધું. કાબરે કાન પકડ્યા, એણે કીધું : ‘હવેથી આવી ભૂલ નહીં કરું હો! ને તરત એ ઊડી ગઈ.

થોડા દિવસ પછી વાડીએ ફરીથી ફરિયાદ કરી, એ કહે :

ભમરાલૈને એવી ધૂન,
ગાતા ફરતા ગુનગુનગુન,
જલદી કરો એવો ઉપાય,
ગુનગુનગુન બંધ થાય.

કેતકીબહેન કહે : ‘ઓહો ! એમાં તે શું ! હમણાં એની ખબર લઈ નાખું છું.’ એણે તો ભમરાને બોલાવ્યો. ભમરો હાજર! કેતકીબહેને તો એના કાનમાંય કશુંક કીધું. ભમરો કહે : ‘હવેથી આવી ભૂલ નહીં કરું, બસ!’ ને એ તરત ઊડી ગયો.

વળી પાછા થોડા દહાડા થયા ત્યાં વાડીએ ફરિયાદ કરી; એ કહે :

શું કે'વું તમને બોલોળ,
ચકલી કરતી ચીં ચીં ચીં....
કાબર સંગે ફર્યા કરે,
ચીં ચીં ચીં કર્યા કરે !



કેતકીબહેન કહે : ‘ઓહો ! એમાં તે શું!...હમણાં ખબર લઈ નાખું છું એની!’ એણે તો ચકલીને બોલાવી. ચકલી તો ફરર કરતી ઉડીને આવી ગઈ.

કેતકીબહેને એના કાનમાં કશુંક કીધું ને ચકલી કહે : ‘કેતકીબહેન, હવેથી આવી ભૂલ નહીં કરું હોં!’ ને એય ફરર કરતી ઉડી ગઈ! વળી થોડા દહાડા થયા ને વાડીએ ફરી પાછી ફરિયાદ કરી, એ કહે :

અંડેરી ગંડેરી રે,
મોરલાએ જંગેડીરે
ટેણુક ટેણુક કરે રે
માથું મારું ભમે રે!

કેતકીબહેન કહે : ‘ઓહો! એમાં તે શું! એ મોરનીય હમણાં જ ખબર લઈ નાખું છું!’ એણે તો મોરનેય બોલાવ્યો. મોર તો તરત હાજર થઈ ગયો. કેતકીબહેને તો એના કાનમાંય કશુંક કીધું, ને એણેય કીધું : ‘કેતકીબહેન, હવેથી હું આવી ભૂલ નહીં કરું હોં!’ ને એય તરત ઉડી ગયો.

કેતકીબહેને પછી વાડીને કીધું : ‘બોલો, હવે છે કોઈની ફરિયાદ?’

વાડી હવે શું બોલે!? એ તો અચરજ પામી ગઈ !

કેતકીબહેન તો હસવા લાગ્યાં, એ કહે : ‘જુઓ, જે કામ બળથી ના થાય, તે કળથી થાય,
સમજ્યાંને મારાં વાડીબહેન!’

વાડી કહે : ‘કેતકીબહેન, તમે કઈ કળ વાપરી એ તો કહો, જરા!?’

કેતકીએ કીદું : ‘જુઓ, કાબર, ભમરો, ચકલી ને મોર આ સૌને મેં એટલું જ કીદું કે : ‘તમે આવા ડાખાડમરા થઈને મૂરખનો સંગ કેમ કરો છો !?’

‘પછી, શું કીદું ?’

‘અરે! વાડી રે વાડી, તમે આટલું જ સમજ્યાં ?....આ દુનિયામાં કોઈ પણ માણસ પોતાને મૂરખ ગણો ખરા?...’

‘ના, ગણો હો! કેતકીબહેન!’ વાડી તો ખુશખુશાલ બની ગઈ.

‘બસ, ત્યારે, એ બધાં ડાખાં પક્ષી એકબીજાથી છૂટાં પડીને ઊડી ગયાં, હવે તો તમારે નિરાંત થઈ ગઈ. આખો દિવસ શાંતિ.....શાંતિ!...’ આમ કહીને કેતકીબહેનેય હસતાં હસતાં એમને ઘેર જતાં રહ્યાં. હવે ?

હવે પાછા થોડા દહાડા પસાર થયા, ત્યાં ફરી પાછી વાડીએ ફરિયાદ કરી! એ કહે :

કેતકીબહેન, ઓ કેતકીબહેન!

પંખી વિના પડે ન ચેન!

કેતકીબહેન તો આ સાંભળીને શું હસ્યાં.....શું હસ્યાં. એ કહે : ખરાં છો તમે વાડીબહેન! હવે પાછું પંખી વગરેય ગમતું નથી?’

વાડી કહે : ‘હા, બહેન, હા!....જરાય ગમતું નથી, હું તો સાવ એકલી પડી ગઈ હો!’....

કેતકીબહેન કહે : ‘ફરી પાછી ફરિયાદ તો નહીં કરોને!?

‘નહીં કરું, બસ!.....’

કેતકીએ તો તરત સાદ પાડ્યો : ‘કાબરબહેન, ભમરાભૈ, ચકલીબહેન, અને મોરલાજી!...આવો, વાડીબહેન બોલાવે છે!’

આ શું! સૌ હાજર થઈ ગયાં! ને વાડી તો રાજી રાજી થઈ ગઈ. પછી તો બધાંએ ભેગાં મળીને મજનાં ગીતો ગાયાં.

